

**Corporate Relations Department BSE Limited Phiroze Jeejeebhoy Towers** Dalal Street, Mumbai - 400 001.

Ref: RCL:KPS:BSE:NEWS-NOTICE-/22:

Date: 8th August, 2022

Dear Sir,

Sub: News Paper Cuttings of Notice for 45th Annual General Meeting & E-voting.

Scrip Code: 500360

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, please find enclosed herewith News Paper Cuttings of Notice for 45th Annual General Meeting & E-voting published on 8th August, 2022 in Business Standard - Ahmedabad and Mumbai edition and in Loksatta-Jansatta - Vadodara edition.

Carbido

Ankleshwar

You are requested to take a note of the same.

Thanking you,

Yours faithfully,

For RAPICAT CARBIDES LIMITED

**Komal Soni** 

(Company Secretary & Compliance Officer)

Encl: As above.



Regd. office: 119, GIDC Industrial Area, Ankleshwar - 393002 Gujarat 

#### Email: investors@rapicutcarbides.com Website: www.rapicutcarbides.com ■ Notice for Annual General Meeting

NOTICE is hereby given that the 45TH ANNUAL GENERAL MEETING ("AGM") of the Members of RAPICUT CARBIDES LIMITED ("Company") will be held on Tuesday, August 30, 2022 at 12:00 Noon through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") pursuant to and in accordance with all the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and rules framed thereunder and in compliance with the procedure prescribed in General Circular No. 20/2020 read with General Circular Nos. 14/2020, 17/2020, 02/2021, 19/2021, 21/2021 and 2/2022 issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India ("SEBI") Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 to transact the Ordinary and Special Business as set out in the Notice convening the AGM. Notice of AGM and Annual Report have been sent through e-Mail to all shareholders whose E-Mail ID is available with the Company/Depositories. A copy of the Notice of AGM and Annual Report are available on the Company's website at www.rapicutcarbides.com, on the website of BSE Ltd at www.besindia.com and on the CDSL website at www.evotingindia.com.

#### ■ Remote E-Voting and E-Voting during AGM

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (LODR), the Company is pleased to provide e-voting (remote e-voting) facility to the Members to cast their votes electronically for the businesses to be transacted at the 45th AGM to be held on 30th August, 2022.

Sr No	Particulars	Schedules
1.	Date & time of commencement	27th August, 2022
	of remote e-voting	at 09.00 a.m.
2.	Date & time of closure of remote e-voting	29th August, 2022 at 5.00 p.m.

The remote e-voting shall be disabled for voting at 5.00 p.m. on 29th August, 2022. The shareholders whose name appears in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on cut-off date of 23rd August, 2022 will be entitled to vote through remote evoting system and through e-voting during the proceedings of AGM. As the AGM will be held through Video Conferencing, facility for Voting through Ballot Papers will not be available at the AGM and the Members attending the Meeting who have not cast their vote by remote e-voting will be able to exercise their right to vote through E-Voting during the proceeding of AGM. The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again.

Any person who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on cut-off date, i.e. 23rd August, 2022, may obtain the login ID and Password by referring to the Notes Section of the Notice convening the AGM. However, if a person is already registered with CDSL for e-voting, then existing Used ID and Password can be used for casting the vote.

Grievances/Queries if any, connected with the e-voting may be addressed through E-Mail at investors@rapicutcarbides.com or can be contacted on 7573022016.

If you have any queries or issues regarding e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free no. 1800 22 55 33

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call at toll free no.

1800 22 55 33 Instructions to join the AGM through Video Conferencing and E-Voting at the AGM is available in the Notes part in the Notice of the AGM.

For Rapicut Carbides Limited Date: 6th August, 2022 Komal P Soni Place: Ankleshwar Company Secretary

#### **POSSESSION NOTICE**

#### **EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LTD.**

CIN: U67100MH2007PLC174759 Retail Central & Regd. Office: Edelweiss House, Off CST Road, Kalina, Mumbai 400098

Whereas, The Authorized Officer of the Secured Creditor mentioned herein, under the Securitisation and Reconstruction o Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 and in exercise of powers conferred under Section 13(12 ead with (Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice as mentioned below calling upor the borrower(s) to repay the amount mentioned in the notice within 60 days from-the date of receipt of the said notice. hereafter, Assignor mentioned herein, has assigned the financial assets to Edelweiss Asset Reconstruction Company

Limited also as its own/acting in its capacity as trustee mentioned hereunder (hereinafter referred as "EARC"). Pursuant to the assignment agreements, under Sec.5 of SARFAESI Act, 2002, EARC has stepped into the shoes of the Assignor and all the rights, title and interests of Assignor with respect to the financial assets along with underlying security interests, guaran tees, pledges have vested in EARC in respect of the financial assistance availed by the Borrower and EARC exercises all its rights as the secured creditor.

SI	Name of	Name of	Loan Account	Borrower Name & Co-Borrower(s) Name	Amount & Date of	Date of	Possession
No	Assignor	Trust	Number		Demand Notice	Possession	Status
1	L&T HOUSING FINANCE LTD.,	TRUST	SRTHL18000353 and SRTHL18000362	Bindu Alpeshsinh     Rajput (Borrower)     Alpeshsingh G Rajput     (Co-Borrower)	₹ 21,07,107.81ps & 03.03.2022	03-08-2022	Symbolic Possession

DESCRIPTION OF THE PROPERTY: The Property Bearing Plot No. 01, Admeasuring 52.80 Sq. Mts. & 39.93 Sq. Mts. Margin, Along Vith 35.40 Sq. Mts. Undivided Share In The Land Of Road & C.O.P., Totally Admeasuring 88.20 Sq. Mts. In "MadhavResidency Situate At Revenue Survey No. 337/2, Block No. 279 (279/1) Admeasuring 1-68-96 Sq. Mts., Of Moje Village Kareli, Ta: Olpad, Dist Surat And The Property Is Bounded As: On The East: Society Road, On The West: Plot No. 18,. On The North: Block No.277, Or The South: Plot No. 02.

2	M/s. AU Small Finance Bank	EARC TRUST SC- 379	L90010607 13612452	Nandlal Ladhabhai Dharaviya (Borrower) 2) Smt Pravinaben Nandlal Dharaviya (Co-Borrower) 3) Ladhabhai Devshibhai Dharaviya (Co-Borrower)	Rs. 9,38,619/- & 20-July-2019	03-08-2022	Symbolic Possession	
---	-------------------------------------	--------------------------	-----------------------	--	-------------------------------------	------------	------------------------	--

Description Of The Property: Particulars of the secured asset - Mortgaged - House No. 121 Khimrana Gamtad at Khimrana Tal, District – Jamnagar Gujarat, admeasuring 331.97 Sq Mtr and construction area 67.84 Sq Mtrs owned by Smt. Pravinabel Nandlal Dharaviya, having four boundaries :- **East-** Property of Ramjibhai, **West-** Common pessage, **North-**Public Road South-Property of Jadhavbhai Mohanbhai Vada.

3	HDB Financial Services Limited.,	EARC TRUST SC-410	6551055	M/s. Parameshwar Corporation (Borrower)     Mr. Mihir Kantilalal Patel (Co-Borrower) 3)     Mr. Kantilal Valjibhai Samani (Co – Borrower)     Ms. Hetal Mihir Patel (Co – Borrower)	₹26,25,258.71ps &	03-08-2022	Symbolic Possession
---	---	-------------------------	---------	---	----------------------	------------	------------------------

Description Of The Property: Immovable Property mortgaged: Shop No.302, Oscar Commercial Complex, Bearing New City Survey No.1183 in Sheet No.285 of ward No.10. Constructed with approval of Jamnagar Municipal Corporation on the Land bearing old City Survey No.1-/G/142 located in the Area Known as Limbda Line in Jamnagar City Area Admeasuring Super built up Area49.89 Sq. Mtrs. And Built Up Area 27.91 Sq. Mtrs. Bounded By: On or Towards North: By Common Passage and Limbda Line Road On or Towards South: By Shop No.307, On or Towards East: By Shop No.301, On or Towards West: Shop No.303

4	L&T HOUSING FINANCE LTD.,	TRUST	SRTHL1800 0233 and SRTHL1800 0352	(Borrower) 2) Maniuben	₹ 21,61,017.04 ps & 14.03.2022	03-08-2022	Symbolic Possession
---	---------------------------------	-------	--	------------------------	--------------------------------------	------------	------------------------

Description Of The Property: All That Right Title And Interest In The Flat No. 501 Admeasuring About 994 Sq Fts. I.E. 92.38 Sq. Mtr. Super Built Up & 646 Sq. Fts. I.E. 60.04 Sq. Mts. Built-Up Of Building No. "J" Of "Bhaktidhara Residency- 2" Together With Undivided Proportionate Land Underneath The Said Building Constructed On Land Bearing Revenue Survey No. 54 Paiki I.E Block No. 128 Of Village Sayan, Taluka Olpad, District Surat. The Said Flat Is Bounded As Follows: East: Adj. Building No. "I", West: Flat No. J/502. North: Flat No. J/504, South: Adj. Open Land.

FINANCE	IRUSI	SRTHL17000972 and SRTHL17000942	1) Nishant Kanubhai Polara (Borrower) 2) Ramilaben Kanubhai Patel (Co-Borrower)	&	04.00.0000	Symbolic Possession
---------	-------	---------------------------------------	---	---	------------	------------------------

Description Of The Property: All Right, Title And Interest In Shop No. 419 On The 4th Floor Admeasuring 280.19 Sq. Feet I.E. 26.04 Sq. Mts. Built Up Area, & 266 Sq. Feet I.E. 24.70 Sq. Mts. Carpet Area, Along With Undivided Share In The Land Of "Western Plaza" Situated At Revenue Survey No. 56+57/ Paiki Block No. 93/Paiki 2 Admeasuring He. Aare. 1-14-59 Sq. Mts., Draft T. P. Scheme No 38 (Nana Varachha), Final Plot No. 55/A & 55/B, Final Plot No. 55/B As Per T.R. Final Plot No. 55/2 Admeasuring 1744 Sq. Mts. Moje Village Nana Varachha, City Of Surat, Owned By, Nishant Kanubhai Polara. And Which Is Bounded As Follow: On Or Towards The East: N/A, On Or Towards The South: N/A, On Or Towards The West: N/A, On Or Towards The North: N/A

6	L&T HOUSING FINANCE LTD.,	EARC TRUST SC-396	and	1) MR. PRIYANK HARSHADB- HAI THAKKAR ("BORROWER") 2) MR. JAYDEEP HARSHADKUMAR THAKKAR ("CO-BORROWER")	₹28.58.170.22	04-08-2022	Symbolic Possession
---	------------------------------------	-------------------------	-----	---	---------------	------------	------------------------

Description Of The Property: The Property bearing Flat No. C-303 on the Third Floor, admeasuring 672.47 sq. feet i.e. 62.47 sq mts. Built-up area, Along with 36.33 sq. mts. undivided share in the land of "Laxmi Residency, Building No. C", Situate at Revenue Survey No. 496/1, 507, Block No. 465/A admeasuring 11635 sq. mts., of Moje Village Kamrej, Taluka Kamrej, Disttrict Surat. That the said property is bounded: On the East: Flat No. C-304, On the West: Flat No. C-302, On the North: Open Land, On the South

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned being the Authorised Officer of Edelweiss Asset Reconstruction Company Limited has taken possession of the properties described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on the date mentioned against each property.
The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, t

edeem the secured assets. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Edelweiss Asset Reconstruction Company Limited for the amount mentioned below

and interest thereon. Sd/- Authorized Office Place: Surat Date: 05.08.2022 Edelweiss Asset Reconstruction Company Limited

\* Edelweiss



बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Sidhpur Main Branch, at-Sidhpur, Tal-Sidhpur, Dist-Patan- 384151. Guiarat. India Phone: 8980039865 • Email ID: sidhpu@bankofbaroda.com & sidhpu@bankofbaroda.co.ii Website: www.bankofbaroda.com

#### POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda, Sidhpur Branch (SOL ID: 0153) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in Exercise of the power conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 12.07.2019 under section 13(2) of the said act calling upon the borrower/guarantor/mortgago Mrs. Laxmiben Nathabhai Parmar (Borrower) residing at 8, Mamta Society, Fulpura, Sidhpur, District-Patan-384151 2. Mr. Hareshkumar Nathabhai Parmar (Co-Borrower) residing at 8, MamtaSociety, Fulpura, Sidhpur, District-Patan 384151 both also residing at- H No 19, Shiv Kutir Residency, Near Shiv Krupa Society, Nr Ramdev Society, Behind J K Party Plot, Nr Umapati Residency, Nr Ramosana to Manav Ashram Road, Mehsana to repay the amount mentioned in the notice being Rs.3,69,643.99 (Rupees Three Lakhs Sixty Nine Thousand Six Hundred Forty Three and Paise Ninety Nine Only) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of power conferred on him/he under section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this 03-08-2022.

The borrower/Guarantor/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda for an amount of Rs.3,69,643.99 and further nterest thereon from 03.03.2019.

The Borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the act, in respect of time available to redeen the secured assets.

#### **DESRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All piece and parcel of Residential Raw House No 19, R S No 1363, Shiv Kutir Residency, Near Shiv Krupa Society, Nr Ramde Society, Behind J K Party Plot, Nr Umapati Residency, Nr Ramosana to Manav Ashram Road, Mehsana Total admeasuring construction area 30.94 Sq. Mtr. And margin land 17.85 Sq Mtr Total 48.79 in the name of Laxmiben Nathabhai Parmai Boundaries: East: Margin land than 6 mtr internal Road, West: Margin Land, North: Plot no 20, South: Plot No 18.

**Authorized Office** Date: 03-08-2022 Place: Mehsana Bank of Baroda, Sidhpur Main



#### **NILA SPACES LIMITED**

(CIN: L45100GJ2000PLC083204)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bunglow, Bodakdev, Ahmedabad - 380 015.

**Phone:** +91 79 4003 6817/18 **Fax:** +91 7930126371

E-mail: secretarial@nilaspaces.com Website: www.nilaspaces.com

#### NOTICE OF 22<sup>ND</sup> ANNUAL GENERAL MEETING TO THE SHAREHOLDERS

NOTICE IS HERERY GIVEN THAT THE 22ND ANNIJAL GENERAL MEETING ("THE AGM") OF THE COMPANY WILL BE HELD ON WEDNESDAY, AUGUST 31, 2022 AT 04.00 P.M. THROUGH VIDEO CONFÉRENCING ("VC")/ OTHER AUDIO-VISUAL MEANS ("OAVM") TO TRANSACT THE BUSINESSES AS MAY BE SET OUT IN THE NOTICE OF THE

In view of the continuing outbreak of the COVID-19 pandemic, the Government of India, Ministry of Corporate Affairs ("MCA"), vide its Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 followed by Circular No. 20/2020 dated May 05, 2020 and Circular 02/2021 dated January 13, 2021 and also Securities Exchange board of India ("SEBI"), vide it's Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 ("Circulars") and clarification dated May 05, 2022, have permitted the holding of AGM through VC/OAVM, without the physical attendance of the Members at a common venue. In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, the AGM of the Members of the Company will be held through VC or OAVM.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2021-22 is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company, Depositories holding shares as on the cut-off date for the dispatch in accordance with the applicable laws Members may note that the Notice of the AGM and Annual Report 2021-22 will also be available on the Company's website- www.nilaspaces.com, website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited, at www.bseindia.com and www.nseindia.com respectively and the AGM Notice is also available on the website of Central Depository Services (India) Limited (CDSL) (agency for providing the Remote e-Voting facility) i.e. www.evotingindia.com. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/ OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). The detailed procedure for remote e-voting/ e-voting are provided in the Notice of the AGM.

n case Member(s) have not registered their e-mail addresses with the Company/ Depository, please follow the below instructions to register e-mail address for obtaining Annual Report and login details for e-voting.

For members holding shares in Physical mode: please provide necessary details like Folio No./ DP/ Client ID, Certificate No., PAN, Mobile No., Email-Id along with the self-attested copy of PAN/ Aadhar/ Valid Passport/ Share Certificate, etc. by e-mail to secretarial@nilaspaces.com

Members holding shares in Demat Mode: can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by e-mail to secretarial@nilaspaces.com

Date: August 08, 2022

For, Nila Spaces Limited By Order of Board of Directors Gopi Dave-Company Secretary

Bandhan Regional Office: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-75

## SYMBOLIC POSSESSION NOTICE

NOTICE is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer issued demand notice to the borrower(s) on the date mentioned against the account stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the public in general and in particular the borrower(s) that the undersigned has taken the symbolic possession of the property described herein below under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the date mentioned against the account. The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the Bank for the amounts, interest, costs and charges thereon. The borrowers'/mortgagors' attention is invited to the provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Name of borrower(s), Loan Account No	Description of the property mortgaged (Secured Asset)	Date of Demand Notice	Date of Symbolic Possession Notice	O/s Amount as on date of Demand Notice
Mr. Mahmedshobibh Abdulgaffer Pathan Mrs. Sajeda Abdulgaffer Pathan	All that piece and parcel of the immovable property situated at R. S. No. 1017, Paiky Plot No. B/68, Haji Park, Jaspur Road, Mouje-Padra, Dist Vadodara and bounded by: North: Plot No. B/69, East: Open Space, R.S. No. 1018, 1018 Land, West: 7.50 Meter Road, South: Plot No. B-67	10.05.2022	02.08.2022	Rs.4,77,550/-

**Authorised Officer Bandhan Bank Limited** 



्री वेंक ऑग़ बड़ोदा | Dadra Branch : Pitru Smruti Building, Vapi-Silvassa Road, Bank of Baroda | Dadra-396193 UT of Dadra Nagar Haveli & Daman & Diu

## POSSESSION NOTICE (Under Rule 8 (1) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas The undersigned being the Authorised Officer of the **Bank of Baroda**, **Dadra Branch** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Act, 2002 and in exercise of powers conferred under Section of security interest (section) And, 2002 and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 07-03-2022 calling upon the Borrowers M/s Dheera Enterprise Prop. Mr. Pramod Kumar Pandey and Guarantor Mr. Mukesh Parmar Pandey to repay the amount mentioned in the notice being Rs. 4,07,799.42 (Rs. Four Lakh Seven Thousand Seven Hundred Ninty Nine and Paise Forty Two only) as on 07.03.2022 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 08.03.2022.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowe and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this 5th day of August of the year 2022.

The Borrower/Guarantor/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, Dadra Branch for an amount of Rs. 4,07,799.42 (Rs. Four Lakh Seven Thousand Seven Hundred Ninty Nine and Paise Forty Two only) as on 07.03.2022 plus interest incidental expenses incurred by bank w.e.f. 08.03.2022. The borrower's attention is invited to sub-section (8) of Section 13 in respect of time available to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

#### Primary Security Hypothecation of Stock and Book Debts

Collateral Security - Extension of equitable mortgage of all the piece and parcel of residential property Flat No. 208 admeasuring 639 square Feet (Super Built up Area) Building E-5 Shree Sai Complex, Opp. Ratan Petrol Pump, Village-Dadra Ut of Dadra and Nagar Haveli Boundaries of above property is as Bounded: On the North by: Flat No. 205, On the South by: Stairs, On the East by: Open Space, On the West by: Flat No. 207. Authorized Office

Place: Dadra

बैंक ऑफ इंडिया Bank of India

Terms & Conditions of E-Auction are as under:

Place: Vadodara

Date: 08/08/2022

#### **ZONAL OFFICE, VADODARA ZONE**

Ellorapark, Subhanpura, Vadodara - 390023. Ph.: (0265) 2396573, 2397032

## STAR MEGA E-AUCTION SALE NOTICE FOR SALE OF **PROPERTIES UNDER SARFAESI ACT 2002**

E-auction sale notice for sale of Immovable assets under the securitisation and reconstruction of financial assets and enforcement of security interest act, 2002 read with provison to Rule 8(6) and rule 6 (2) of the Security Intereest (Enforcement) Rules, 2002 Notice is here by given to the public in gereral and in particular to the following Borrower(S) & Guarantor(S) that the below described immovable properties mortgaged/charged to Bank of India (secured creditor), the Physical Possession of which has taken by the Authorised Officer of Bank of India will be sold on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS" and "WHATEVER THERE IS BASIS" for recovery of respective dues as detailed hereunder against the secured assets mortgaged/charged to Bank Of India from the respective Borrower(S) and Guarantor(S). The reserve price and the earnest money deposit is shown there against secured asset. The sale will be done by the undersigned through e-Auction platform provided hereunder.

DATE AND TIME OF AUCTION: 07.09.2022 between 11.00 noon to 05.00 pm (with Auto extension clause in case of bid in last 10 minutes before closing) Minimum EMD Date/Time of

 Sr. Name of the Borrower/Guarantor/Owner/Partner/ No. Mortgagor of the property	Lot No	Details of Property to be Sold	Details of Bank dues as per Notices	Possession	Minimum Reserve Price (Rs. in Lac)	EMD (Rs. in Lac)	Date/Time of E-Auction
GHOD DOD ROAD	BR	ANCH, 4 BOI Complex, Opp. Panjara Pole, Ghod Dod Road, Surat	, Gujarat - 395 001. Ph.: 0261-2236754/2236755, Mob	ile No. 8	0842 7062	5	
M/S Mirrikh Motors Pvt Ltd - Owner/Mortgagor  1. Faruk Mohmadbhai Mahida, Mr. Javidbhai Umedbhai Mahida	1		As per Notice U/S 13(2) 02.04.2019 <b>Rs. 15,33,30,717.31</b> (Rupees Fifteen Crore Thirty Three Lacs Thirty Thousand Seven Hundred Seventeen and Paise Thirty One only) plus further interest and cost incidental expenses etcrecovery if any		Rs. 965	Rs. 96.50	<b>07.09.2022</b> 11 AM to 5 PM

The measurement of above property/ies however be verified by bidders at site and also from the revenue records prior to participating in auction.

1. E-Auction is being held on "as is where is basis", "as is what is basis", "as is what is basis" and will be conducted "On Line", before submitting bid EMD shall be deposited through NEFT/Found Transfer in working hours on or before 06.09.2022, 2. For downloading further details, Process Compliance and Terms & Conditions, Please visit:- a https://www.bankofindia.co.in, b. Website address of our e-Auctions Service Provider - https: // www. mstcecommerce.com / auctionhome /ibapi/ index.jsp Bidder may visit https://www.ibapi.in where "Guidelines" for bidders are available with educational videos. Bidders have to complete following formalities well in Advance: Step 1 Bidder/Purchaser Registration: Bidder to register on e-Auction Platform (link given above) using his mobile number and email-id, Step 2: KYC Verification: Bidder to upload requisite KYC documents. KYC documents shall be verified by e-Auction service provider (may take 2 working days). Step 3: Transfer of EMD amount to Bidder Global EMD Wallet: Online/off-line transfer of fund using NEFT/Transfer, using challan generated on e-Auction Platform., Step 4: Bidding Process and Auction Results: Interested Registered bidders can bid online on e-Auction Platform after completing Step 1, 2 and 3. Please note Step 1 to Step 2 should be completed by bidder well in advance, before e-Auction date., 3. To the best of knowledge and information of the Authorised Officer, there is no encumbrance on the property/ies. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property/ies put on auction and claims/rights/dues/affecting the property, prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorised Officer/Secured Creditor shall not be responsible in any way for any third party claims/rights/dues. No claim of whatsoever nature will be entertained after submission of the online bid regarding property/ies put for sale. 4. Date of Inspection 18.08.2022 from 11.00 am to 4.00 pm with prior appointment with mentioned respective branches on the contact numbers given against respective branches. 5. Bids shall be submitted through online procedure only. 6. Bidders shall be deemed to have read & understood the terms & conditions of sale & be bound by them. 7. The Bid price to be submitted shall be above the Reserve price & bidders shall improve their further offers in multiples of Rs. 10,000/- (Rupees Ten Thousand only)., 8. It shall be the responsibility of the interested bidders to inspect and satisfy themselves about the property before submission of the bid. 9. The Earnest Money Deposit (EMD) of the successful bidder shall be retained towards part sale consideration and the EMD of unsuccessful bidders shall be refunded. 10. The Earnest Money Deposit shall not bear any interest. The successful bidder shall have to deposit 25% of the sale price ncluding EMD already paid, immediately on acceptance of bid price by the Authorised Officer and the balance of the sale price on or before 15th day of sale. The auction sale is subject to confirmation by the Bank. Default in deposit of amount by the successful bidder would entail forfeiture of the whole money, already deposited and property shall be put to re-auction and the defaulting bidder shall have no claim/right in respect of property/amount. 11. Neither the Authorised Officer/Bank nor e-Auction service provider will be held responsible for any Internet Network problem/Power failure/any other technical lapses/failure etc. In order to ward-off such contingent situation the interested bidders are requested to ensure that they are technically well equipped with adequate power back-up etc. for successfully participating in the e-Auction event., 12. The purchaser shall bear the applicable stamp duties/Registration fee/other charges, etc and also all the statutory/non-statutory dues, taxes, assessment charges, etc. owing to anybody. 13. The Authorised Officer/Bank is not bound to accept the highest offer and has the absolute right & discretion to accept or reject any or all offer(s) or adjourn/postpone/cancel the e-Auction or withdraw any property or portion thereof from the auction proceeding at any stage without assigning any reason there for. 14. The Sale Certificate will be issued in the name of the purchaser(s)/applicant (s) only and will not be issued in any other name(s). 15. Th sale shall be subject to rules/conditions prescribed under the Security Interest Act, 2002. Further details/enquiries if any on the terms and conditions of sale can be obtained from the

espective branches on the contact numbers given. 16. This is also a mandatory notice of 15 days as per provision or the SARFAESI Act to the Borrowers/Guarantors/Mortgagers of the above accounts informing them about holding of sale/Auction aforesaid date. **Authorised Officer, Bank of India** Date: 08.08.2022 - Place: Vadodara

# ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાંથી ચેક ચોરી ૬૫.૧૫ લાખની ઉચાપત

## ચોરી કરેલો ચેક ધી આફવા વિકાસ મંડળીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયો

ફતેપુરા,તા.૭

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના -એકાઉન્ટ ઓફિસમાંથી ગત તારીખ ૧/ ૮ /૨૦૨૨ પહેલા કોઈપણ સમયે ફતેપુરા ના પી.એલ.એ ટુ ટીડીઓ ના નામના એકાઉન્ટ નંબરની ચેકબુકમાંથી એક કોરો છે નંબર ૩૪૬૮૨૦ થી ધી આફવા વિભાગ મ. કા. સહકારી મંડળીના સંચાલક રાજેશભાઈ ભેમાભાઈ લબાના રહે આફવા તા ફતેપુરા જિલ્લો દાહોદ રાજેશભાઈ ભેમાભાઈ લબાના વિરુદ્ધ નાઓ એ ચોરી કરી આ ચેકમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાના આવ્યો છે ફતેપુરા તાલુકા પંચાયત નામની ખોટી સહી સિક્કા કરી કચેરીમાં એકાઉન્ટ તરીકેની કામગીરી ઝાલોદ એસ બી આઇ બેક્રમાં જમા સંભાળતા હિમાંશુભાઈ ભાનુપ્રસાદ જતા એકાઉન્ટર તેમજ ટી ડી ઓએ કરાવી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી ભાવસારની ઓફિંસ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાના કચેરી ના પહેલા માળે આવેલી છે આ

આફવા વિભાગ મ. કા. સહકારી મંડળીના ખાતામાં જમા કરાવી તે ખાતામાંથી નાણા ઉપાડી લઇ સરકારી નાણાંની ગેરીતી કરતા ફતેપુરા મગનસિંહ ઠાકોર દ્વારા તપાસ કરી ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી ચેકની ચોરી કરી લાખો રૂપિયા ઉપાડી લેનાર સરકારી એકાઉન્ટમાંથી રૂપિયા કચેરીની ઓફિસની ચાવી પટાવાળા

દપ,૧૫,૫૪૭ પુરા ઉપાડી લઈ ધી પાસે રહે છે જ્યારે એકાઉન્ટની તિજોરી ની ચાવી હિમાંશુભાઈ પાસે રહે છે ત્યારે આ ચેક રાજેશભાઈ ભેમાભાઈ લબાના પાસે કઈ રીતે આવ્યો હશે ? તેના પર સિક્કા ક્યાંથી લાવ્યો હશે ? તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ તેવા અનેક સવાલોનો જવાબ પોલીસ તપાસમાં આવશે તાલુકા પંચાયતનની ઓફિસમાં ડેપ્યુટી એકાઉન્ટર તરીકે ભાવસાર હિમાંશુભાઈ ફરજ બજાવે છે અને તે જ એકાઉન્ટ ને લગતી કામગીરી કરે છે ત્યારે તેઓને રોજમેળમાં ચેક બુકમા ચેક નંબર ૩૪૬૮૨૦ ના મળતા ટીડીઓને જણ કરી હતી ચેક ન મળતા શંકા કુશંકા તપાસ કરતા ચેક ઝાલોદ એસ બી આઇ બેક્રમાં રૂપિયા ૬૫.૧૫.૫૪૭

જમા થયલો મળેલ ચેક જોવા માટે બેક મેનેજર ને ટીડીઓ કહેતા ચેક ટેઝરી ઓફિસમાં મોકલી આપ્યો છે ટ્રેઝરી ઓફિસમા કામ કરતાં કર્મચારીને મળીને ઉપરોક્ત ચેક નંબર કોની સહી કરેલી છે તે જોવા માટે માંગતા ચેકમાં જોતા તાલુકા વિકાસ અધિકારીના સિક્કો તથા સહી કરેલ હતો ચેકમાં તાલુકા વિકાસ અધિકારીની સહી હતી તેનો ફોટો પાડી લાવી ફરી એસ બી આઈ બેક્ર માં આવતા બેંકમાં આપેલા સહીના નમુના સાથે સરખાવતા ફેરફાર લાગતા (બરાબર )મળી આવેલ ન હતી બનાવટી સિક્કા અને સહી કરીને બારોબાર રૂપિયા ઉપાડી લીધા હતાં તાલુકા વિકાસ અધિકારીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ભરી આફવા મ.કા.સહકારી મંડળીમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

#### ઝાડેશ્વર નર્મદા નદીમાં દશા માતાની મૂર્તિઓનું વિસર્જન

ભરૂચ,તા.૭

ભરૂચ પંથકમાં સહિત ગ્રામ્ય વિસ્તારમાં દર વર્ષે દશામાતાજી ના ભક્તોની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામા ભક્તોએ માં દશામાતાજીનું વ્રત કર્યું હતું. તેમજ વ્રતની પૂર્ણાહૂતિ થતાં મોતાની મૂર્તિનું ભક્તિ ભાવના સાથે વિસર્જન કર્યું હતું.વ્રતના અંતીમ દીવસે ભકતો દ્વારા જાગરણ કરવામા આવ્યું હતું. તેમજ આખી રાત માતાજીના ભજન કીર્તનનાં કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતું. વહેલી સવારે કથા અને આરતી બાદ, આંખોમાં લાગણી અને હર્ષના આંસુઓ સાથે ભક્તોએ માં દશામા માતાને ભાવ ભીની વિદાય આપી હતી. ત્યારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પુરતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે દશામાની મૂર્તિઓનું વિતરણ કરાયું છે. મૂર્તિઓના વિસર્જન સ્થળ પર કંકુ, ચૂંદળી, નાહીયેર સહિતના પૂજાગરીના

# સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ હારા તિરંગાનું અપમાન ?



સંખેડા. હાલમાં હર ધર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. દરેક નાગરિક તિરંગા સાથે સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરી રહ્યા છે પરંતુ તિરંગાની આમાન્ય પણ જળવાવી તો જોઈએ ને! સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સત્તાના નશામાં ભાન ભૂત્યા હોય તેમ જણાય છે. તેઓનો તિરંગા સાથેનો ફોટો વાયરલ થયો છે જેમાં તેઓ તિરંગા પર બૂટ પહેરીને ઊભા હોય તેમ જણાય છે. આ મુદ્દે આ નેતા સામે પગલાં લેવાશે કે કેમ? એ જોવું રહ્યું.

## લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે વિરપોર ગામના યુવાને એકના ડબલ કરવાની લાલચમાં ૨૦લાખ ગુમાવ્યાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ

રાજપીપલા,તા.૭

ડિપોઝિટ કર્યા, અંતે યુવાને ૨૦ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

મધ્યપ્રદેશની સિવાય એગ્રો પ્રોડ્યુસર કંપનીમાં રિકરિંગ તેમજ ફિક્સ ડિપોઝિટમાં સારું વળતર આપતી હોવાની વાત ઢોલાર ગામના વેગેન્દ્ર વસાવા, સાંઢીયા ગામના ઉપરી અધિકારીને જાણ કરી છે પ્રવીણ ઉક્કડ તડવી, ઝોબુઆ મધ્યપ્રદેશના પંકજસિંહ ભરતસિંહ ટગરિયા અને રાજચંદ્ર ડાવરે વિરપોર ગામના મનોજ પ્રતાપસિંહ વસાવાને કરી હતી. એમની પર વિશ્વાસ મૂકી મનોજે પ લાખની ૪ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

એફ.ડી મળી કુલ ૨૦ લાખ રૂપિયા લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે 🛮 ૯ વર્ષની મુદત માટે ફિકસ ડિપોઝિટ ન મરે કેહવતને સાર્થક કરતી ઘટના કર્યા હતા.મનોજને એમ પણ જણાવ્યું નાંદોદ તાલુકામાં બની છે.વિરપોર હતું કે ૯ વર્ષે તમને ૨૦ લાખના ગામના યુવાને ૯ વર્ષમાં રૂપિયા ૬૦ લાખ મળશે અને જો અધવચ્ચે ડબલ થશે એવા લોભમાં ૨૦ લાખ રકમ ઉપાડવી હશે તો અમુક ચાર્જ રૂપિયા ખાનગી કંપનીમાં ફિકસ કપાઈ વ્યાજ સહિત રૂપિયા મળશે. હવે મનોજને અધવચ્ચે નાણાંની જરૂરિયાત ઊભી થતાં એણે વેગેન્દ્ર વસાવાને જાણ કરી હતી. પણ બન્યું એમ કે મણોજ જ્યારે પણ વેગેન્દ્ર પાસે નાણાંની વાત કરે તો એને એક જ દિલાસો મળતો હતો કે અમારા રૂપિયા તમને મળી જશે.પરંતુ મનોજને એમણે અત્યાર સુધી એના રોકેલા રૂપિયા પરત ન કરતા મનોજે એ ૪ લોકો વિરૂદ્ધ રાજપીપલા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને

# ભે ગામે બનેલા બનાવમાં ફરિયાદીએ જ આ કૃત્ય કર્યું હોવાનો પર્દાફાસ કુંવારી પુત્રી એ જ બાળકીને જન્મ આપતા બાળકીને કૂવામાં તરછોડી દેવાયાનો ઘટસ્ફોટ

ગરબાડા તાલુકાના ભે ગામે એક ચાલીસ ફૂટ ઊંડા કૂવામાં તરછોડી દેવાયેલી બે દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જેને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવી હતી પરંતુ બીજે દિવસે તેનું મૃત્યુ થયું છે બીજી તરફ આ ઘટનામાં ફરિયાદીએ જ આ કૃત્ય કર્યું હોવાનો પર્દાફાસ થયો છે કારણ કે તેની કુંવારી પુત્રી એ જ આ બાળકીને જન્મ આપ્યો હતો જેથી પોલીસે તે બંને સામે કાર્યવાહી હાથ ધરી છે. ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળિયામાં રહેતા હઠીલા પરીવારના માલિકીના કુવામાં તેમને એક નવજાત બાળકી જોવા મળી હતી તેમણે ઘડેલી વાર્તા પ્રમાણે તેમણે સરપંચને જાણ કર્યા બાદ પોલીસ કડીઓ મળી હતી અને તેના આધારે



હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરિયાદ નોંધાવતા આગળની તપાસ શરૂ કરી હતી પોલીસે ભેગામ અને આસપાસના વિસ્તારમાં કેટલી સગર્ભાઓ હતી અને કેટલી પ્રસુતિ થઈ છે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી આ તપાસમાં પોલીસને કેટલીક આવીને નવજાત બાળકીને ઝાયડસ પહેલા રહસ્યનો પર્દાફાસ થયો જેમાં

પોલીસના જણાવ્યા પ્રમાણે આ નવજાત બાળકીને જન્મ આપનાર કુવાના માલિક હઠીલાની દોહિત્રી છે જેથી હવે પોલીસે હઠીલા અને તેન<u>ી</u> દોહીત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હઠીલાની દીકરી મધ્યપ્રદેશમાં રહે છે અને તેની આ દોહિત્રી થોડા સમયે પહેલા જ ભે ગામમાં આવી હતી તેની ઉંમર ૧૮ વર્ષ ઉપર છે આખી ઘટના પ્રકાશમાં આવ્યા પછી તેને કોઈ તકલીફ ન થાય તેવા હેતુથી ગરબાડા સીએચસીમાં ખસેડવામાં આવી છે તબીબી સૂત્રના જણાવ્યા મુજબ આ યુવતી અપંગ છે જેથી તે ચાલી શકતી નથી એક થી બીજા સ્થળે જવા માટે તેણે જમીન પર ઢસડાઇને જવું પડે છે કુદરતે આપેલી આ વિકલાંગતા વચ્ચે હવે તેણે કાયદાના કટઘરામા આવવું પડશે તે નિશ્ચિત છે.

## નર્મદાજિલ્લાના મહિલા ક્લાસ ૧ અધિકારીને ન્હાતા જોનાર યુવાન વિરૂદ્ધ ફરિયાદ

રાજપીપલા.તા.૭

નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ક્લાસ ૧ અધિકારી તરીકે ફરજ બજાવતા જિલ્લાના એક મહિલા ઉચ્ચ અધિકારી રાજપીપલા વડીયા જકાત નાકા નજીકના સર્કિટ હાઉસ ખાતે હરિસિધ્ધિ કક્ષ રૂમમાં રેહતા હતા. તેઓ પોતાની દૈનિક ક્રિયાના ભાગ રૂપે બાથરૂમમાં ન્હાવા ગયા હતા, કોઈ સ્ત્રીને ન્હાતી વખતે કોઈ જોવે નહિ એવી અપેક્ષા હોય છે.દરમિયાન ત્યાંનો એક યુવાન અભિષેક નરેન્દ્રભાઈ સોલંકી (રહે. વાવડી) મહિલા અધિકારીને એમની જાણ બહાર બારીની બહારના ભાગેથી ન્હાતા જોતો હતો.જો કે મહિલા અધિકારીને આ બાબતે ભાસ થતા એમણે તુરંત એ યુવાનને ઠપકો આપ્યો હતો.નર્મદા જિલ્લાના મહિલા અધિકારીએ યુવકને સબક શિખવવા રાજપીપલા પોલીસ મથકમાં અભિષેક નરેન્દ્રભાઈ સોલંકી વિરૂદ્ધ છેડતીની ફરિયાદ

નીચે સહી કરનારે **બેંક ઓફ બરોડાના** અધિકૃત અધિકારી તરીકે સિક્યોરીટાઈઝેશન એન્ रिङन्स्ट्रङ्शन ओइ इार्धनान्सियस असेट्स अन्ड अन्झेर्सभेन्ट ओइ सिड्योरीटी र्धन्टरेर (द्वितिय) વટહુકમ કાયદો, ૨૦૦૨ (૨૦૦૨ નો વ. ૩) હેઠળ અને સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ(એન્કોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ ૯ સાથે વંચાતી ક્લમ ૧૨(૧૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને **તા. ૦૬/૦૪/૨૦૧૯ ના રોજ** માંગણા નોટીસ જારી કરીને દેવાદાર **મે રાફીયા એન્ટરપ્રાઇઝ અને તેના પ્રોપરાયટર (શ્રી મહંમદમતીન મહંમદમહેમુદ ખાન)** ને નોટીસમ જણાવેલ **રા. ૬,૪૩,૫૧૨.૦૦ (રા. છ લાખ તેંતાલીસ હજાર પાંચસો બાર પુરા)** તરીકેની રકમ

. દેવાદાર રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, અહીં દેવાદાર અને જાહેર નતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે અહીં નીચે વર્ણવેલી મિલકતનો કબ<u></u>જો ક્છિત નિયમોના નિયમ ૮ સાથે વંચાતી કથિત વટહકમ કાયદાની ક્લમ ૧૩(૪) હેઠળ તેમને/તેણીને મળેલી સત્તાની રૂએ **૦૩ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ લઇ લીધો છે.** 

સિક્ચોર્ડ મિલકતો છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે , કાયદાની કલમ ૧૩ની પેટા-કલમ (૮ ની જોગવાઈઓ પ્રત્યે દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે.

ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે મિલકત સાથે કોઈપણ વ્યવહાર કરવો નહી અને મિલકત સાથે કરાયેલા કોઈપણ વ્યવહારનો ચાર્જ **બેંક ઓફ બરોડાની** બાકી **રૂા. ૬,૪૩,૫૧૨.૦૦ (રૂા. છ લાખ તેંતાલીસ હજાર પાંચસો બાર પુરા)** તરીકેની રકમ અને ચૂકવણીની તારીખ સુધી કરારના દરે તેની પરના આગળના વ્યાજ વત્તા કિંમતો ચાર્જિસ અને ખર્ચાઓને આધિન રહેશે.

મિલકતના તે તમામ પાર્ટ અને પાર્સલ **શ્રી મહંમદમતીન મહંમદમહેમુદ ખાનના ના**યે મોજે ગામ વડોદરા કસબા, તા. અને જી. વડોદરાના ટીકા નં. ૮/૪, સિટી સર્વે ન ૮૨૧ થી ૮૨૮, સર્વે નં. ૪૬૧/૧ અને ૪૬૪ તેમના એક્ક્રિત ૨૯૩૪ ચો.મી.માપન ૪૬૪/٩/٩ ની બીન ખેતીલાચક જમીન પર બંધાચેલ ફોનિક્ષ કોમ્પલેક્ષ તરીકે શિર્ષિત સ્કીમમાં સ્થિત ૫મા માળે ૧૦૦.૦૦ ચો.ફીટ માપ ધરાવતી ઓફિસ નં. ૫૨૩ તરીકેની સ્થાવર કોમર્શિયલ મિલકત. **ચતુઃસીમાઃ પૂર્વઃ** કોમન પેસેજ, **પશ્ચિમઃ** 

સહી/- અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા તારીખઃ ૦૩.૦૮.૨૦૨૨

#### ગોધરામાં જુગારના અક્રા પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: ચારનીધરપકડ

ગોધરા.તા.૭

ગોધરા શહેરના ગેની પ્લોટ પાસે મેશરી નદીના પટમાં જુગાર ધમધમતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. જ બાતમીના આધારે સ્ટટ મોનીટરીંગ સેલના પોલીસકર્મીઓએ ધારાસભ્ય દ્વારા ચાંદલગઢ ખાતે ધમધમતા જુગારધામ પર દરોડો આવેલી વન વિભાગ ની જમીનમાં પાડ્યો હતો.પોલીસે સ્થળ પર થી ગેરકાયદે બાંધકામ કરીને જમીન ચાર જુગારીયાઓની ધરપકડ કરી હતી. જયારે જુગારધામ ચલાવનાર તાલુકા પંચાયત સદસ્ય વાડી બેઠક મહંમદશખફી અબ્દુલસલામ બદામ રહે,ગોધરા નાશી છૂટવામાં અગ્રણી દુષ્યંત સિંહ દ્વારા કરવામા સફળ રહ્યો હતો પોલીસે ચાર આવ્યો હતો. વિધાનસભા ગૃ જુગારિયાઓની અંગ ઝડતી હતા ઉપાધ્યક્ષ સામે મંદિર ની દરમ્યાન રોકડ રૂ.૩૫ ૩૯૦ અને બાજુમાં આવેલી જમીનમાં ઉપાધ્યક્ષ જેઠા ભરવાડને રૂબરૂમાં ચાર મોબાઈલ ફોન મળી કુલ કરવામાં આવેલા બાંધકામ ને રૂ. ૬૪,૦૦૦ ઉપરાંત નો મુદામાલ લઈને કાર્યવાહી થાય તે માટે બજવણી માટે ગયા હતા. આ બે કંબ્જે લીધો હતો. પોલીસના હાથે હાઈકોર્ટમાં રિટ પિટિશન થોડા સીદિક ઈસાક મીઠા રહે,ગોધરા મહિના પહેલા દાખલ કરવામાં કામરાન હનીફ છકડા રહે,ગોધરા ભાવેશ અશોકભાઈ રાણા રહે,લુણાવાડા ચિરાગકુમાર ભોઈ રહે,લુંશાવાડા નાઓને પોલીસે ઝડપી પાડચા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા ના પગલે સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. તમામ જુગારીયાઓ સહિત જુગારધામ ચલાવનાર સામે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

# વિધાનસભાના ગૃહના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સામે જંગલની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ

# હાઇકોર્ટમાંથી આપેલ નોટિસની કોંગ્રેસના જશવંતસિંહ અને દુષ્યંતસિંહ દ્વારા ધારાસભ્ય જેઠા ભરવાડને બજવણી

પચમહાલ ના શહેરાના પચાવી પાડી હોવાનો આક્ષેપ ના જે.બિ.સોલંકી અને કોંગ્રેસ આવી હતી.અરજદાર જે.બી. સોલંકી અને દુષ્યંત સિંહ ચોહાણ ને હાઇકોર્ટ દ્વારા ચાંદણગઢ ટ્રસ્ટ



આવી હતી.જેને લઇને જે.બી. સોલંકી અને દુષ્યંતસિંહ ચૌહાણ પોલીસ બંદોબસ્ત સાથે રવિવાર ના રોજ વિધાનસભા ગૃહના હાઇકોર્ટે આપેલ નોટિસની અરજદાર જે.બિ.સોલંકી અને દુષ્યંત સિંહ ચોહાણ પોલીસ સાથે ધારાસભ્ય કાર્યલાય ઓફિસ ખાતે પહોંચી જઈને હાઇકોર્ટ માંથી તેમના પરીવાર ના સભ્યોને રૂબર્ર ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ની મચી જવા પામ્યો છે

નોટિસની બજવણી સોંપવામાં સહી કરાવીને બજવણી કરી હતી. હાઇકોર્ટમાં આ બે અરજદાર એ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ સામે સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરવાને લઈને લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.હાલ તો કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્ય વાડી બેઠકના જશવંતસિંહ સોલંકી અને દુષ્યંત સિંહ ચૌહાણ દ્વારા વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ ને હાઇકોર્ટમાં આપેલ નોટિસની પોલીસની આપેલ નોટિસને રૂબરૂ બજાવતા ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ રૂબરૂમાં વિધાનસભા ગૃહના સમગ્ર રાજકીય ક્ષેત્રે ખડભળાટ

# અંકલેશ્વરના દઢાલ પાસે અમરાવતી નદીમાં ડૂબી જતા બે યુવકના મોત અંકલેશ્વર, તા.૭ મૂર્તિનું વિસર્જન કરતા જતા તેઓ

અંકલેશ્વર તાલુકા ના દઢાલ ગામ પાસે આવેલ અમરાવતી નદી માં રહેતા બે યુવકો ડૂબી જતા લાપતા શોધખોળ કરતા બંજ્ઞે યુવકો ના મૃ તદેહ ને શોધી કાઢી બહાર કાઢ્યાં હતા તાલુકા પોલીસે બંજો મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

અંકલેશ્વરના દઢાલ ગામ પાસે આવેલ અમરાવતી ખાડીમાં દશામાં ની મૂર્તિનું વિસર્જન કરવા રવિવારે વહેલી સવારે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટવાની શરૂ થઈ ગઈ હતી. અંકલેશ્વર જીઓઇડીસીની ક્રિસ્ટલ ચોકડી નજીક રહેતા બિહાર ના એક પરિવારના સભ્યો સાથે બે યુવાનો પણ વિસર્જન માટે આવ્યા હતા.વિસર્જન દરમ્યાન સાથે આવેલ ૧૭ વર્ષીય સુરજ સંજય શર્મા, અને ૧૮ વર્ષીય રવિદાસ સહિત ત્રણ યુવાનો હાથ ધરી છે.

ડૂબવા લાગ્યા હતા.જેઓને જોઈ પરિવારની મહિલાઓએ બુમરાણ દશામાં ની મૂર્તિ ના વિસર્જન સમયે મચાવતા સામાજિક કાર્યકર હિતેશ જીઆઇડીસી ની ક્રિસ્ટલ ચોકડી પાસે વસાવા ત્યાં દોડી આવ્યા હતા ં અને તેઓએ એક યુવાનને ડૂબતા બનતા ફાયર ના જવાનો એ ભારે બચાવી લીધી હતો. જ્યારે સુરજ અને રવિ અ લાપત્તા બન્યા હતા જે બાદ તેઓએ ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરતા પ્રથમ રવિદાસનો મૃતદેહ મળી

આવ્યો હતો. જ્યારે સૂરજ શર્મા લાપત્તા બનતા તેની શોધખોળ હાથ ધરી હતી. અઢી કલાકની જહેમત બાદ સુરજનો પણ મૃતદેહ મળી આવતા પરિવારમાં વિસર્જનનો પ્રસંગ ઘેરા શોકમાં ફેરવાઈ ગયો હતો. ઘટનાને પગલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને .બન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે િડેસ્પેન્સરી ખાતે ખસેડી વધુ તપાસ

## રેપીક૮ કાર્બાઇક્સ્ લિમિટેક ઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, અંકલેશ્વર ૩૯૩૦૦૨, ગુજ ફોન : ૭૫૭૩૦૨૨૦૧૬/ ૭૬૨૨૦૦૨૨૦૩ Email: investors@rapicutcarbides.com વાર્ષિક સાદારણ સભા ની નોટીસ

નોટીસ આપવામાં આવે છે કે રેપીકટ કાર્બાઇડસ્ લીમીટેડ ની ૪૫ મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) મંગળવાર, ઓગષ્ટ ૩૦, ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી)/ અન્ય ઓડિઓ વિત્ર્યુઅલ માધ્યમ (ઓએવીએમ) દ્વારા કંપનીઝ એક્ટ ૨૦૧૩ તથા કોર્પોરેટ બાબતો ना मंत्रालय द्वारा शहेर हरायेला सामान्य परिपत्र नं १४/२०२०, १७/२०२०, २०/२०२०, ०२/२०२१, १६/२०२१, २१/२०२१ अने ०२/२०२२ ना परिपत्रो अने ભारतीय प्रतिलूति अने पिनिभय जोर्ड (સેબી) ના સરકયુલર SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 અને SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 नुं पालन डरीने नोटीस मां જણाવેલ સાધારણ અને વિશેષ કામકાજને બહાલી આપવા ચોજાશે.

જે શેરધારકો ના ઇ-મેઇલ સરનામાં કંપની/ડિપોઝિટરી સાથે નોંધાચેલા છે, તેઓને વાર્ષિક સામાન્ય સભાની નોટીસ તેમજ એન્યુઅલ રીપોર્ટ કંપની દ્વારા તે સભ્યોને ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવેલ છે. અહેવાલની નકલ કંપની ની વેબસાઇટ www.rapicutcarbides.com તેમજ બીએસઇ ની વેબ સાઇટ www.bseindia.com તથા CDSL ની વેબસાઇટ

#### www.evotingindia.com પર ઉપલબ્ધ છે ઇ-વોટિંગ ની નોટીસ અને રીમોટ ઇ-વોટીંગ

કંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૧૦૮ અને કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમીનીસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ (સુધારા પ્રમાણે) ના નિયમ ૨૦ તથા સેબી (એલઓડીઆર) ૨૦૧૫ ની કલમ ૪૪ પ્રમાણે કંપનીએ ૪૫ મી વાર્ષિક સાધારણ સભા જે 30 મી ઓગષ્ટ, ૨૦૨૨ ના રોજ રાખેલ છે તેમાં સભાસદોને ઇ-વોટીંગ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી દરેક સભાસદ ઇ-વોટીંગ દ્વારા મત આપી શકશે.

અનુ નં.	વિગત	પરિશાષ્ટ
٩	ઇલેક્ટ્રોનિક વોટીંગની	તા. રહમી ઓગષ્ટ, ૨૦૨૨
	શરૂઆતનો દિવસ અને સમય	સવારે ૯:૦૦ કલાકે
5	ઈલેક્ટ્રોનિક વોટીંગ બંધ થવાનો દિવસ અને સમય	તા. રહમી ઓગષ્ટ, ૨૦૨૨ સાંજે પઃ૦૦ કલાકે
ടെപു ചു		લ્લાક રામાં કાન્યામાં મહિલ

બંધ કરવામાં આવશે. જે સભાસદોના નામ સભાસદ રજીસ્ટર અથવા ડીપોઝીટરીઝનાં બેનીફીશિયલ ઓનરનાં રજસ્ટરમાં કટ ઓફ તારીખ **૨૩ મી** ઓગષ્ટ. ૨૦૨૨ ના રોજ હશે તેઓ રીમોટ ઇ-વોટીંગ સીસ્ટમથી અથવા વાર્ષિક સામાન્ય સભા ની કાર્ચવાહી દરમ્યાન ઇ-વોટીંગ કરી શકશે. વાર્ષિક સામાન્ય સભા વિકિઓ કોન્ફરન્સ (વીસી), અન્ય ઓકિઓ વિઝ્યુઅલ માધ્યમ (ઓએવીએમ) થી થનાર હોચ બેલેટ પેપર થી વોટીંગ ઉપલબ્ધ નથી જેથી જે સભાસદોએ રીમોટ ઇ-વોટીંગ દ્વારા મત આપેલ નથી તેઓ સભા ની કાર્ચવાહી हरभ्यान ઇ-पोटींग थी तेमनो मत आपी शङ्शो. के सलासहों तेओना मत વાર્ષિક સામાન્ય સભા પહેલા રીમોટ ઇ-વોટીંગ દ્વારા મત આપેલ છે તેઓ સભા માં હાજર રહી શકશે પરંતુ વાર્ષિક સાધારણ સભામાં મત આપી શકશે

જે વ્યક્તિ એજીએમ ની નોટીસ મોકલ્યા પછી અને કટ ઓફ તારીખ ૨૩ મી ઓગષ્ટ, ૨૦૨૨ ના રોજ કંપનીના સભાસદ ની ચાદીમાં હશે તેઓ તેમનો Login ID અને Password એજીએમ નોટીસ ના નોટસ્ સેક્શન માં જઇ મેળવી શકશે. જો કોઇ વ્યક્તિ CDSL પર પહેલેથી રજીસ્ટર હોય તો હાલનાં Login ID

અને Password થી ઇ-વોટીંગ કરી શકશે. ઇ-પોટીંગ અંગે કોઇ ફરીયાદ કે પ્રશ્ન હોય તો કંપની ના સેક્રેટરીયલ ડિપાર્ટમેન્ટ ના ઇ-મેઇલ investors@rapicutcarbides.com અથવા ફોન નં ७૫७૩०२२०१५ પર સંપર્ક કરી શકે છે.

જો તમારી પાસે CDSL ની ઇ-વોટીંગ સીસ્ટમ માં ઇ-વોટીંગ સંબંધે પરેશાની અથવા સમસ્યાઓ હોય તો તમે helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ કરી શકો છો અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૨૫૫૩૩ પર સંપર્ક કરી શકો

ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન કરવાની સુવિધા માં થતી પરેશાની અંગે શ્રી રાકેશ દળવી, સીનિયર મેનેજર, સેન્ટ્રલ ડીપોઝીટરી સર્વીસ (ઇન્ડીયા) લિ. એ વીંગ, ૨૫ મા માળે, મેરેથોન કુચરેક્સ, મફતલાલ મીલ કંપાઉન્ડ, એન.એમ. જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઇ ૪૦૦૦૧૩ ને ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૨૫૫૩૩ પર સંપર્ક કરી શકો છો અથવા

helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ કરી શકો છો. વિકિઓ કોન્ફરન્સ દ્વારા વાર્ષિક સામાન્ય સભા ની કાર્ચવાહીમાં ભાગ લેવા

અને ઇ-વોટીંગ કરવા માટે ની સુચનાઓ વાર્ષિક સામાન્ય સભા ની નોટીસ માં રેપીકટ કાર્બાઇક્સ્ લી. વતી ક્રોમલ પી. સોની ક્રંપની સેક્રેટરી dl. 09/02/2022 સ્થળ ઃ અંકલેશ્વર



નવુ નામ પરમાર શારદાબેન **ะเนซูผเย** (Ravjibhai) રાખેલ છે.

રામ ચૌક, વાડી, વડોદરા.

મારૂ જુનુ નામ ચૌહાણ

શારદાબેન રાવજીભાઇ

દું રાકેશફમાર દીનેશભાઇ પટેલ મારી સગીર દિકરીનું જુનુ નામ ใใช่แ (Vishva) **राडेशइभार पटेल** હત્ બદલીને નવુ નામ વિશ્વા (Vishwa) રાકેશકુમાર પટેલ રાખેલ છે. ૧, અક્ષરધામ બંગ્લો,

અટલાદરા, વડોદરા.

મારૂ જુનુ નામ ચૌહાણ જયેન્દ્ર રાવજીભાઇ (Ravajibhai) હતુ બદલીને નવુ નામ ચૌહાણ જચેન્દ્ર રાવજીભાઇ (Ravjibhai) રાખેલ છે. રામ ચોક, વાડી, વડોદરા.

भा३ रुनु नाभ વર્ષાબહેન રસીકલાલ શાહ હતુ બદલી નવુ નામ વર્ષા કીર્તિકુમાર શાહ રાખેલ છે. એ-30૧, બંસરી સ્કેવર, આજવા રોક, વકોદરા.

મારૂ જુનુ નામ ચૌહાણ राप्रभार्थ (Ravajibhai) નરસિંહભાઇ હતુ બદલીને નવુ નામ પરમાર રાવજીભાઇ ( Ravjibhai) **ศะให่ธุผเย่** રાખેલ છે. રામ ચૌક, વાડી, વડોદરા.

Bandhan રીજનલ ઑફિસઃ નેતાજી માર્ગ, મીઠાખળી છ રસ્તા પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-૬. ફોનઃ ૯૧-૭૯-૨૬૪૨૧૬૭૧-૭૫

#### સાંકેતિક કબજા અંગેની નોટિસ

ધ સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઑફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૧૨) हેઠળ આપવામાં આવેલી સત્તાઓ, કે જેનો અર્થ ધ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ માં આપવામાં આવ્યો છે, તે સત્તાઓનો ઉપયોગ કરતાં નોટિસ આપવામાં આવે છે કે, અધિકૃત અધિકારીએ, અહીં જણાવેલાં ખાતાંનાં દેવાદારોને ડિમાન્ડ નોટિસ પાઠવી હતી અને તેમાં તે નોટિસ મબ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર, રકમ ભરપાઈ કરી દેવા માટે જણાવ્યું હતું. દેવાદાર આ રકમ ભરવામાં નિષ્ફળ ગયા હોવાથી, દેવાદાર અને જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે, નીચે સહી કરનાર વ્યક્તિએ,ઉપરોક્ત ધારાની કલમ ૧૩ની પેટા કલમ (૪) જેનો અર્થ ઉપરોક્ત ધારામાં નિયમ ૮ માં આપવામાં આવ્યો છે—તે મુજબ તે વ્યક્તિ (નીચે સહી કરનાર) ને મળેલી સત્તાનો ઉપયોગ કરીને, તેણે અહીં નીચે જે મિલકતનું વર્ણન આપવામાં આવ્યું છે, તે મિલકતનો સોકેતિક ક્બજો લઈ લીધો છે. આથી, ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને ચેતવવામાં આવે છે કે તે મિલકત અંગે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને છતાં જો તે મિલકત અંગે કોઈ પણ પ્રકારનો વ્યવहાર કરવામાં આવશે તો તે અંગેની રકમ, વ્યાજ, ખર્ચ અને શુલ્ક બાબતે, બેંકને આંધીન રહેશે. સિક્યોર્ડ એસેટ રીડીમ કરવા / પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભે કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ તરક કરજદાર /ગીરો મકનારનં ધ્યાન દોરવામાં આવે છે.

		-					
દેવાદારનું નામ, લોન ખાતા નં.	મોર્ટગેજ મિલકતનું વર્ણન (સિક્ચોર્ડ એસેટ)	ડિમાન્ડ	સાંકેતિક કબજા અંગેની	ડિમાન્ડ નોટિસની તારીખ			
	<b>5</b>	નોટિસની તારીખ	નોટિસની તારીખ	મુજબ બાકી રકમ			
શ્રી અબ્દુલગફર મિન્હાસજુદ્ધીન પઠાણ	તમામ ચલ અને અચલ સંપત્તિ, જે આર.એસ. નંબર ૧૦૧७, પૈકી પ્લોટ નંબર બી/૬૮, હાજી પાર્ક,	૧૦.૦૫.૨૦૨૨	0२.0८.२0२२	રૂ.૪,७७,૫૫०/-			
	જાસપુર રોડ, મૌજે–પાદરા, જિલ્લો વડોદરા સ્થિત છે અને જે આવરિત છેઃ						
શ્રીમતી સાજેદા અબ્દુલગફર પઠાણ	ઉત્તરઃ પ્લોટ નંબર ઇ/૬૯, પૂર્વઃ ખુલી જગ્યા, આર.એસ. નંબર ૧૦૧૮, ૧૦૧૮ જમીન, પશ્ચિમઃ						
	७.૫૦ મીટર રોક, દક્ષિણઃ પ્લોટ નંબર બી–૬७						
સ્થળઃ વડોદરા							

તારીખઃ ૦૮/૦૮/૨૦૨૨









બંધન બેંક લિમિટેડ







**PUBLIC NOTICE** Notice is hereby given to the public that my client Mr. Mukesh Madhukar Patel nd Mrs. Bhavana Mukesh Patel, inten to purchase flat from Mrs. Urmila Ganesl Agashe and Mr. Omkar Ganesh Agash vidow and son of late Mr. Ganes Kashinath Agashe, flat bearing no.101 wing –B, in building known as **the Hi** wing –B, in building known as tne min
Park Co-operative Housing Society imited that the original owner of the said flat was Mr. Ganesh Kashinath Agashe, who expired on dated 16/05/2021and thereafter Mrs. Urmil Ganesh Agashe and Mr. Omkar Ganesl Agashe being the widow and son have represented to have the lawfu ession and right to sell the said flat. Any person/s having any claim o objections with respect of said flat, within a period of 14 days from the publication of this notice, with copies o documentary proofs to support the claim. C/102, New Sajawat Complex CHS Ltd., Near Sangam Medical, Acho Road, Nallasopara (E), Tal. Vasai, Dis Palghar If no claim is received within th period prescribed above, the negotiatio will be completed and be presumed that here are no such claims and if any, the same have been waived or abandoned

laims made thereafter Adv. Umesh H. Rana

and my client will be free to complete th

ourchase without any reference to suc

**Customer Name** 

Nilesh Bhimrao Jadhav

Sanidev Basdev Paswan

Bijoy Raju Varghese

Ganesh Anant Bhagat

Ganesh Anant Bhagat

Ganesh Anant Bhagat

Mittal Kanti Shah

Arif Anwar Khan

Kartikeya Watts

Kartikeva Watts

Hamza Irfan Dolare

Haresh Chandrakant Sathale

Vomesh Mahender Punia

Srienat Praveen Shetty

Rakesh Gajanan Pawar

Yusuf Mohammad Vhora

Sujeet Radheshyam Singh

Frank Charles Samson, Carrick

Frank Charles Samson Carrick

Santosh Kumar Kedarsingh Rajput | XXXXXXXXXXX4297

Juvale Nikhat Aasim

Mukund Kusha Naik

Sanjana Sanjay Dukhande

Rakesh Anant Mhatre

Naseemullah Jamal Khan

Sunayana Tushar Bare

Podirla Chiranjeevi

Tushar Hanumant Parab

Shabbir Abdulhamid Shaikh

Subrata Manabendra Saha

Subrata Manabendra Saha

Naushaba Dulare Sayyed

Nimesh Ashok Makadia

Satish Jotiram Hajare

Satish Jotiram Hajare

Swapnil Patil

Neha Dubev

Place : Mumbai

Sayyed Shoeb Shammi

Mahesh Mahadev Bhagat

Daspelli Srikanth

SaifAli

#### कार्यपालक अभियंता का कार्यालय पेराजल एवं स्वच्छता प्रमण्डल, चक्रधरपर E-mail-eedwsd.chakradharpur@gmail.com

#### आवश्यक सूचना

सर्व साधारण को सूचित किया जाता है कि इस कार्यालय द्वारा आमंत्रित अल्पकालीन ई० निविदा, जो जल जीवन मिशन के तहत वित्तीय वर्श 2021-22 में चक्रधरपुर प्रमण्डल अंतर्गत Construction of Solar Based Mini Water Supply Schemes(SVS) in Different Block, comprising of suitable R.C.C/Framed structure ESR, Distribution Lines, Source (as required) and FHTC all complete job in the Different block से संबंधित है तथा जिसका ई0 निविदा सूचना संख्या — SVS/MWSS in different Block :-04/2021-22 (2nd Call ), दिनांक 29.12.2021 तथा जिसका PR संख्या – PR 260698 (West Singhbhum) 21-22,D है, के ग्रुप संख्या – Cluster 1A – Goilkera एवं Cluster 7B - CKP (E) को अपरिहार्ये कारणों से अगले आदेश तक के लिए रद्द किया जाता है।

(ई0 प्रभु दयाल मंडल) कार्यपालक अभियंता PR 275304 West Singhbhum (22-23)\_D पेयजल एवं स्वच्छता प्रमण्डल, चक्रधरपुर

Outstanding

Amount

544349

58400

34523

174935

535069

372656

1642906

118499

142502

55550

257153

205804

359286

69433

413275

263988

122552

135930

180834

99726

52352

237827

94091

313983

292820

46593

439034

228916

129817

1390245

84658

330124

376342

106649

668375

634126

303716

178330

146411

429697

1018921

AXIS BANK Ltd.

**Public Notice for Auction** 

**Public Notice For - Auction Of Pledged Assets Being Gold Ornaments** 

The Borrowers, in specific and the public in general are here buy notified that public auction of the

gold ornaments pledge in the below accounts is proposed to be conducted by the Axis Bank at

The below mentioned Borrowers has availed the credit facility from the Axis Bank Limited against the

pledge of gold ornaments ("Gold Loan Facility") in favour of the Bank towards the security. The

Demand notices were issued to the Borrowers/Guarantors calling up the Borrowers/Guarantors to

pay their outstanding amount towards the Gold loan facility availed. As the Borrowers/ Guarantors

have failed to repay the outstanding loan amount, the bank is constrained to invoke the pledge and

proposed to conduct an e-auction sale of pledged gold ornaments more particularly described in

schedule of property hereunder on 18th August 2022 at 12.30 pm to 3.30 pm on "As is Where is".

BHANDUP, MUMBAI [MH]

DINDOSHI, MUMBAI [MH]

DOMBIVLI(E), MUMBAI [MH]

GOREGAON LINK ROAD, MUMBAI [MH

KALYAN(W) [MH]

KAMOTHE, NAVI MUMBAI [MH]

KANDIVLI(E), MUMBAI [MH]

KANJURMARG EAST MUM MH

MANPADA, MUMBAI (MH)

MIRA ROAD, MUMBAI [MH]

MURBAD. THANE [MH]

NALASOPARA(W), MUMBAI [MH]

NERUI -FAST MUMBAI [MH]

NEW MARINE LINES. MUMBAI [MH]

PEN [MH]

SION, MUMBAI [MH]

THANE [MH]

VASAI, MUMBAI [MH]

VASHI, MUMBAI [MH]

VILE PARLE(E), MUMBAI [MH]

Loan A/c No.

XXXXXXXXXXX7314

XXXXXXXXXXX3765

XXXXXXXXXXX6444

XXXXXXXXXXX3822

XXXXXXXXXXX5241

XXXXXXXXXXX6317

XXXXXXXXXXX0287

XXXXXXXXXXX3850

XXXXXXXXXXX3824

XXXXXXXXXXX1403

XXXXXXXXXXX5374

XXXXXXXXXXX5156

XXXXXXXXXXX5375

XXXXXXXXXXX3799

XXXXXXXXXXX2674

XXXXXXXXXXXX0389

XXXXXXXXXXX7179

XXXXXXXXXXX6509

XXXXXXXXXXXX0552

XXXXXXXXXXX8314

XXXXXXXXXXX1839

XXXXXXXXXXX8943

XXXXXXXXXXX5621

XXXXXXXXXXX3202

XXXXXXXXXXXX8148

XXXXXXXXXXX2161

XXXXXXXXXXX7599

XXXXXXXXXXX1862

XXXXXXXXXXX2823

XXXXXXXXXXX4398

XXXXXXXXXXX9287

XXXXXXXXXXX5610

XXXXXXXXXXX6732

XXXXXXXXXXXX0384

XXXXXXXXXXX4723

XXXXXXXXXXX8647

XXXXXXXXXXX1734

XXXXXXXXXXX7127

XXXXXXXXXXX5703

XXXXXXXXXXX9795

notice. Auction will be held online https://gold.samil.in between 12.30 pm to 3.30pm.

For detailed Terms and conditions, please log into given website https://gold.samil.in

VIRAR [MH]

Axis Bank Ltd. has the authority to remove account/change the auction date without any prior

"As is What is", "Whatever There is" and "No Recourse Basis".

#### **E-TENDER NOTICE- 30/2022-23** MAHAGENCO

- CHP/ e-tender 196/ Rfx No.3000031384 :- AMC FOR HOUSEKEEPING/CLEANING OF COAL DUST FROM BOTH SIDE WALKWAYS / BELT STRUCTURE OF RUNNING CONVEYOR BELTS IN 2 X 250 MW CHP, PARAS TPS. (Esti. Cost :- (Rs. 271.52 Lacs EMD:-Rs. 275025/-)
- C&I/ e-tender 197/ Rfx No.3000031400:- Procurement of air filters regulators with pressure gauge & its sintered filter at Paras TPS. (Esti. Cost: - (Rs. 1.37 Lacs EMD: - Rs.
- CHP/ e-tender 198/ Rfx No.3000031399 :- Procurement of various filters of Cummins Engine KT-1150-C, NTA 855LBC & VTA28L fitted on Bulldozer & Locomotives at Paras TPS. (Esti. Cost:-(Rs. 5.37 Lacs EMD:-Rs. 8873/-)
- Selling period for above tender Sr. No. 1 to 3 from 07.08.2022 to 27.08.2022
- Submission on dated 28.08.2022 at 16.00 Hrs

Note:-For detail please see our web site:-https://eprocurement.mahagenco.in

**CHIEF ENGINEER MAHAGENCO TPS PARAS** 

#### Kriti Nutrients Ltd.

CIN No: L24132MP1996PLC011245

Regd. Office: Mehta Chambers, 34, Siyaganj, Indore-452 007 (M.P.) Phone: 0731-2719100/ 26 E-mail: cs@kritiindia.com; Website: www.kritinutrients.com

#### Unaudited Financial Results for the Quarter Ended on 30th June, 2022

₹ in Lacs (Except Earnings Per Share

Sr.	Particulars	Quarter Ended 30.06.2022	Year Ended 31.03.2022	Quarter Ended 30.06.2021
No.		(Unaudited)	(Audited)	(Unaudited)
1.	Total income from operations Sales / Income from Operations	19,490.44	75,623.40	16,083.46
2.	Net Profit / (Loss) for the period (Before tax, exceptional and / or Extraordinary items)	307.64	1,683.16	262.61
3.	Net Profit / (Loss) for the period before tax (After exceptional and / or Extraordinary items)	307.64	1,683.16	262.61
4.	Net Profit / (Loss) for the period after tax (After exceptional and / or Extraordinary items)	208.15	1,230.52	195.19
5.	Total Comprehensive Income for the Period (Comprising Profit / (Loss) for the Period (After Tax) and Other Comprehensive Income (After Tax)	209.08	1,239.43	192.37
6.	Equity Share Capital (Face value of ₹ 1 each)	501.04	501.04	501.04
7.	Reserves (excluding Revenue Reserve) as shown in the audited balance sheet of the previous year.		10,749.38	
8.	Earnings Per Share (of ₹ 1 each) (for continuing and discontinued operations) - (a) Basic : (b) Diluted :	0.42 0.42	2.46 2.46	0.39 0.39

Gross

weight

162.10

19.88

10.65

60.77

215.28

117.53

585.22

38.97

49.64

19.80

93.71

96.47

120.69

31.50

121.69

80.00

39.70

43.30

55.20

340.30

29.88

16.26

84.94

62.87

123.08

88.95

15.00

138.07

69.90

47.98

547.78

27.60

99.69

115.86

29.67

210.87

220.10

102.93

67.38

66.89

149.88

Authorized Officer,

Axis Bank LTD.

Date of

Recall Notice

28-02-2022

18-06-2022

17-05-2022

18-07-2022

18-07-2022

22-06-2022

20-05-2021

17-05-2022

18-06-2022

17-05-2022

18-07-2022

22-06-2021

18-07-2022

17-05-2022

18-07-2022

30-03-2022

18-07-2022

18-07-2022

18-07-2022

02-12-2020

24-03-2022

29-01-2022

18-07-2022

09-06-2022

22-06-2021

07-07-2022

18-06-2022

24-03-2022

12-06-2021

18-07-2022

22-06-2022

17-05-2022

17-05-2022

18-07-2022

21-04-2022

24-03-2022

24-03-2022

18-07-2022

18-07-2022

20-06-2022

20-05-2021

- 1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Regulrements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange (www.bseindia.com) & and on company's website (www.kritinutrients.com)
- 2) The above results have been reviewed by the Audit Committee in it's meeting held on 6th August, 2022 and taken on record by the Board of Directors in its meeting held on 6th August, 2022
- 3) The Limited Review as required under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements)
  - Regulations, 2015 has been completed by the auditors of the company

For Kriti Nutrients Ltd.

Shiv Singh Mehta Place : **INDORE** (Chairman & Managing Director) Date: 6th August, 2022 DIN 00023523

PUBLIC NOTICE MR. PANALAL MULCHAND KANSARA & MRS. RAMILA PANALAL KANSARA were members of LOYAL CO OPERATIVE HOUSING SOCIET LIMITED, Bearing Registration No BOM/HSG/2671 of 1970., having address at Dr. Annie Besant Road Worli, Mumbai - 400 018., jointly witl their son i.e. MR. HITESH PANALA KANSARA (hereinafter referred to a said society) and were holding the Share Certificate No. 86 for Five fu paid up shares of Rupees Fifty each Bearing distinctive numbers from 301 305 (Both inclusive) and holding Fla admeasuring about 99.00 Sq.Mtrs Built-up area, Bearing No. P-3 o Sixteenth Floor along with Covere Garage Bearing No. 'P-3' in the buildir known as EDEN HALL of LOYAL C OP. HOUSING SOCIETY LIMITEI (hereinafter for the sake of brev referred to as 'Said Flat'). MR. PANAL MULCHAND KANSARA & MRS RAMILA PANALAL KANSARA die intestate on or about 19.09.2006 an 17.05.2010 respectively at Mumba without making any nomination.

In the premises hereinabove, said M HITESH PANALAL KANSARA is co owner and entitled to 1/3rd undivide right, title, interest, share & claim of sa Flat and said shares of said society. The society has received an applicat from MR HITESH PANALA KANSARA for transfer of the dece members rights in the said flat and the

relevant Share Certificate.

The society hereby invites claim objections from the heir or heirs or other claimants/ objector or objectors to th transfer of the said shares and interes of the deceased members in the capital/property of the society in favour of MR. HITESH PANALAL KANSARA within a period of Fifteen days from t publication of this notice, with copies such documents and other proofs support of his/her/their claims objections for transfer of shares an interest of the deceased members the capital/property of the society. If r claims/objections are received with the period prescribed above, the society shall be free to deal with the shares and interest of the deceas members in the capital/ property of th society in such manner as is provide under the bye-laws of the society. The claims/objections if any, received by the society for transfer of shares an interest of the deceased members i the capital/ property of the society sha dealt with in the manner provided under the Bye-Laws of the society. A copy of the registered Bye-Laws of the soci available for inspection by the claimants/objector, in the office of the society/with the Secretary of the Society between 10.00 am to 05.00 pm from the date of publication of the notic till the date of expiry of its period. For and on behalf of

Loyal Co-op. Housing Society Limited (Hon. Secretary) Date: 08.08.2022

'FORM 'Z' (See sub-rule [11(d-1)] of rule 107)

Possession Notice for

Immovable Property Whereas the undersigned being Recovery officer of the Charkop Om Shree Siddhivinayak CHS Ltd. Under the Maharashtra Cooperative Societies Rules, 1961 ssued a demand Notice dated 08/04/2022 calling upon the

Shri. Bipin Dayalal Savla to repay the amount mentioned in the notice being **Rs. 1,73,239/-**(Rupees One Lakh Seventy Three Thousand Two Hundred and Thirty Nine only) with date of receipt of the said notice and the judgment debtor having failed to repay the amount, the undersigned has issued a notice for attachmen dated 31/05/2022 and attached the

property described herein below. The judgment debtor having failed to repay the amount, notice is hereby given to the judgment debtor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under rule 107 (11(d-1)] of the Maharashtra Co-operative Societies Rules, 1961 on this 15 Day of July of the year 2022.

The judgment debtor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Charkop Om Shree Siddhivinayak CHS Ltd, for an amount Rs.1,73,239/- (Rupees One Lakh Seventy Three Thousand Two Hundred and Thirty Nine only) and interest thereon.

Description of the Immovable Property

Room No. D-12 Charkop Om Shri Siddhivinayak CHSL Plot No - 941 RSC – 17 Sector-9, Charkop Kandivali (W), Mumbai - 400067

All that part and parcel of the perty consisting of Room No. D-12 Charkop Om Shri Siddhivinayak CHSL Plot No-941 RSC - 17 Sector - 9, Charkop Kandivali (W), Mumbai - 400067. Within the registration Tahsil Borivali and District - Mumba Suburban Date: 15/07/2022 ( Seal )

Place: Mumbai B.N. GAIKWAD Special Recovery & Sales Officer, Co-op. Societies, Maharashtra State Charkop Om Shree Siddhivinayal CHS Ltd., Mumba

#### **EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LTD.**

CIN: U67100MH2007PLC174759 Retail Central & Regd. Office: Edelweiss House, Off CST Road, Kalina, Mumbai 400098

#### **APPENDIX IV** [rule-8(1)] **POSSESSION NOTICE (for Immovable property)**

Whereas, The Authorized Officer of the Secured Creditor mentioned herein, under the Securitisation and Reconstruction of Financia Assets and Enforcement of Security Interest (Act), 2002 and in exercise of powers conferred under Section 13(12) read with (Rule 3 of the Security Interest (Enforcement) Rules. 2002 issued a demand notice as mentioned below calling upon the borrower(s) to repa he amount mentioned in the notice within 60 days from-the date of receipt of the said notice.

Thereafter, Assignor mentioned herein, has assigned the financial assets to Edelweiss Asset Reconstruction Company Limited also as its own/acting in its capacity as trustees as EARC TRUST SC -417 (hereinafter referred as "EARC") vide Assignment Agreement Pursuant to the assignment agreement, under Sec.5 of SARFAESI Act, 2002, EARC has stepped into the shoes of the Assignor and all the rights, title and interests of Assignor with respect to the financial assets along with underlying security interests, guarantees pledges have vested in EARC in respect of the financial assistance availed by the Borrower and EARC exercises all its rights as the

Name of	Name of	Loan Account	Borrower Name &	Amount & Date	Date of	Possession	
Assignor	Trust	Number	Co-Borrower(s) Name	of Demand Notice	Possession	Status	
Edelweiss	EARC TRUST	LMUM0HL0000	Dharmendra B Gandhi	₹ 1,37,60,982.44/-	02.08.2022	Symbolic	
Housing Finance	SC-417	000576/	(Borrower)	02-05-2022		Possession	
Limited (EHFL)		LMUM0TU0000	2. Mrs. Divya Dharmendra Gandhi				
		003689	(Co-Borrower)				
D 1 ( OCT D 1 AUG 1 1 1 C) 1 ( 1 C) 1 ( 1 C) 2 (							

Description Of The Property: All the piece and parcel of the proper situated at Flat 703, 7th Floor, B wing, "Anupam", Dattaram Khamkar Marg ,Off Dr Ambedkar Marg , Near Gundecha Garden, Lalbaug Market, Lalbaug, Mumbai 400012. Bounded as follows: North: Building ,South: Internal Road, East: Play Ground, West: Internal Road

he borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned being the Authorised Officer of **Edelweiss Asset Reconstruction Company Limited** has taken possession of the properties described ierein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interes Enforcement) Rules, 2002 on the date mentioned against each property. he borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Edelweiss Asset Reconstruction Company Limited for the amount mentioned below and interest thereon.

Authorised Officer
Edelweiss Asset Reconstruction Company Limited



#### **Kasta**®

# Kriti Industries (India) Ltd. CIN No: L25206MP1990PLC005732

## Financial Results for the Quarter Ended 30th June, 2022

		STANDALONE			CONSOLIDATED		
Sr.	B # 1	Quarter Ended		Year Ended	Quarter Ended		Year Ended
No.	Particulars	30.06.2022	30.06.2021	31.03.2022	30.06.2022	30.06.2021	31.03.2022
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Total income from operations Sales / Income from Operations	18,678.29	15,420.46	54,608.84	18,678.29	15,420.46	54,608.84
2.	Net Profit / (Loss) for the period (Before tax, exceptional and / or Extraordinary items)	(897.13)	842.11	1,783.61	(883.13)	842.11	1,808.46
3.	Net Profit / (Loss) for the period before tax (After exceptional and / or Extraordinary items)	(897.13)	842.11	1,900.16	(883.13)	842.11	1,925.01
4.	Profit / Loss from Discontinued Operations (Before Tax)	-	-		(0.05)	582.56	551.33
5.	Net Profit / (Loss) for the period after tax (After exceptional and / or Extraordinary items)	(924.49)	644.54	1,403.38	(910.54)	1,232.02	1,993.23
6.	Total Comprehensive Income for the Period (Comprising Profit / (Loss) for the Period (After Tax) & Other Comprehensive Income (After Tax)	(928.59)	646.44	1,386.96	(914.64)	1,233.92	1,976.82
7.	Equity Share Capital (Face value of ₹ 1 each)	496.04	496.04	496.04	496.04	496.04	496.04
8.	Reserves (excluding Revenue Reserve) as shown in the audited balance sheet of the previous year.			14879.49			14,917.71
9.	Earnings Per Share (of ₹ 1 each) (for continuing and discontinued operations) - 1. Basic : 2. Diluted :	(1.86) (1.86)	1.30 1.30	2.83 2.83	(1.84) (1.84)	2.48 2.48	4.02 4.02

- company's website (www.kritiindustries.com). 2) The above results have been reviewed by the Audit Committee in it's meeting held on 6th August, 2022 and taken on record
- by the Board of Directors in its meeting held on 6th August, 2022 . 3) The Limited Review as required under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations

For Kriti Industries (India) Ltd (Shiv Singh Mehta)

# Regd. Office: Mehta Chambers, 34, Siyaganj, Indore-452 007 (M.P.) Kriti Phone: 0731-2719100/ 26, E-mail: cs1@kritiindia.com, Website: www.kritiindustries.com

# **Extract of Audited Statement of Standalone and Consolidated**

₹ III Lacs (Except Earnings Per Share)								
			STANDALONE			CONSOLIDATED		
Sr.		Quarter Ended		Year Ended	Quarte	r Ended	Year Ended	
No.	Particulars	30.06.2022	30.06.2021	31.03.2022	30.06.2022	30.06.2021	31.03.2022	
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1.	Total income from operations Sales / Income from Operations	18,678.29	15,420.46	54,608.84	18,678.29	15,420.46	54,608.84	
2.	Net Profit / (Loss) for the period (Before tax, exceptional and / or Extraordinary items)	(897.13)	842.11	1,783.61	(883.13)	842.11	1,808.46	
3.	Net Profit / (Loss) for the period before tax (After exceptional and / or Extraordinary items)	(897.13)	842.11	1,900.16	(883.13)	842.11	1,925.01	
4.	Profit / Loss from Discontinued Operations (Before Tax)	-	-	-	(0.05)	582.56	551.33	
5.	Net Profit / (Loss) for the period after tax (After exceptional and / or Extraordinary items)	(924.49)	644.54	1,403.38	(910.54)	1,232.02	1,993.23	
6.	Total Comprehensive Income for the Period (Comprising Profit / (Loss) for the Period (After Tax) & Other Comprehensive Income (After Tax)	(928.59)	646.44	1,386.96	(914.64)	1,233.92	1,976.82	
7.	Equity Share Capital (Face value of ₹ 1 each)	496.04	496.04	496.04	496.04	496.04	496.04	
8.	Reserves (excluding Revenue Reserve) as shown in the audited balance sheet of the previous year.			14879.49			14,917.71	
9.	Earnings Per Share (of ₹ 1 each) (for continuing and discontinued operations) - 1. Basic : 2. Diluted :	(1.86) (1.86)	1.30 1.30	2.83 2.83	(1.84) (1.84)	2.48 2.48	4.02 4.02	
Notes:  1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation								

33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchanges (www.bseindia.com) & (www.nseindia.com) and on

DIN 00023523

Regd. office: 119, GIDC Industrial Area, Ankleshwar - 393002 Gujarat Email: investors@rapicutcarbides.com Website: www.rapicutcarbides.com

**Rapicut Carbides Limited** 

## ■ Notice for Annual General Meeting

NOTICE is hereby given that the 45TH ANNUAL GENERAL MEETING "AGM") of the Members of RAPICUT CARBIDES LIMITED ("Company") will be held on Tuesday, August 30, 2022 at 12:00 Noon through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") pursuant to and in accordance with all the applicable provisions of the Companies Act. 2013 "the Act") and rules framed thereunder and in compliance with the procedure rescribed in General Circular No. 20/2020 read with General Circular Nos. 4/2020, 17/2020, 02/2021, 19/2021, 21/2021 and 2/2022 issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India "SEBI") Circular Nos SEBI/HO/CED/CMD1/CIB/P/2020/79 and SEBI/HO/CED/CMD2/CIB/P/2022/62 to transact the Ordinary and Special Business as set out in the Notice convening the AGM. Notice of AGM and Annual Report have been sent through e-Mail to all shareholders whose E-Mail ID is available with the Company/Depositories. A copy of the Notice of AGM and Annual Report are available on the Company's website at www.rapicutcarbides.com, on the website of BSE Ltd at www.besindia.com and on the CDSL website at www.evotingindia.com

#### ■ Remote E-Voting and E-Voting during AGM

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time and Regulation 44 of the SEB (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (LODR), the Company is pleased to provide e-voting (remote e-voting) facility to the Members to cast their votes electronically for the businesses to be transacted at the 45th AGM to be held on 30th August, 2022.

	3 7				
S	r No	Particulars	Schedules		
1.	Date & time of commencement of remote e-voting		27th August, 2022 at 09.00 a.m.		
2.		Date & time of closure	29th August, 2022		

The remote e-voting shall be disabled for voting at 5.00 p.m. on 29th August, 2022. The shareholders whose name appears in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on cut-off date of 23rd August, 2022 will be entitled to vote through remote evoting system and through e-voting during the proceedings of AGM. As the AGM will be held through Video Conferencing, facility for Voting through Ballot Papers will not be available at the AGM and the Members attending the Meeting who have not cast their vote by remote e-voting will be able to exercise their right to vote through E-Voting during the proceeding of AGM. The members who have cast their vote by remote e-voting prior to the AGM

may also attend the AGM but shall not be entitled to cast their vote again. Any person who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on cut-off date, i.e. 23rd August, 2022, may obtain the login ID and Password by referring to the Notes Section of the Notice convening the AGM. However, if a person is already registered with CDSL for e-voting, then existing Used ID

and Password can be used for casting the vote. Grievances/Queries if any, connected with the e-voting may be addressed through E-Mail at investors@rapicutcarbides.com or can be contacted on

If you have any queries or issues regarding e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or

contact at toll free no. 1800 22 55 33

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call at toll free no.

1800 22 55 33 Instructions to join the AGM through Video Conferencing and E-Voting at the AGM is available in the Notes part in the Notice of the AGM.

For Rapicut Carbides Limited Date: 6th August, 2022 Komal P Soni Place: Ankleshwar Company Secretary

Place: INDORE Date: 6th August, 2022